FINANCIAL EXPRESS

STERLING POWERGENSYS LIMITED

Regd Off: Office No. 121, Runwal Commercial Complex Co-Op Premises Ltd, L.B.S. Marg, Mulund (West) Mumbai-400080, Maharashtra, India.

CIN: L29213MH1984PLC034343; Email Id.: sterlingstrips84@gmail.com; Ph No. 022-25605588; Website: www.splsolar.in

Statement of Audited Financial Results for the Quarter Ended & Year Ended March 31, 2022. (RS. in Lakh)

Sr.	Particulars	Quarter	Ended	Year	Ended
No.		31.03.2022 (Audited)	31.12.2021 (Audited)	31.03.2022 (Audited)	31.03.2021 (Audited)
1	Total Income from Operations	7.05	13.85	134.58	40.42
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	-26.36	-17.78	10.30	-80:20
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	-26.36	-17.78	10.30	-110.20
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	-26.36	-17.78	10.30	-110.20
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income(after tax)]	-26.36	-17.78	10.30	-110.20
6	Equity Share Capital	509.60	509.60	509.60	509.60
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year			-701.64	-711-94
8	"Earnings Per Share (of Rs.10/-each) (for continuing and discontinued operations)-				
	1.Basic: 2.Diluted:"	-0.52 -0.52	-0.35 -0.35	0.20 0.20	-2.16 -2.16

NOTES:

1. The above is an extract of the detailed format of Quarterly & Annual Financial Results for the period ended 31/03/2022filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing & Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the websites www.bseindia.com& on the Company's website i.e. www.splsolar.in.

2. The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 30th May, 2022.

Date: 31.05.2022

Place : Mumbai

No.

FOR STERLING POWERGENSYS LIMITED SANKARAN VENKATA SUBRAMANIAN (M.D.)

MMP INDUSTRIES LIMITED

Registered Office: 211 Shrimohini, 345-Kingsway Nagpur-440001, MH-IN CIN No.: L32300MH1973PLC030813 | Email: companysecretary@mmpil.com | Website: www.mmpil.com



Extract of Financial Results For The Quarter and Year Ended 31st March, 2022

			STANDALONE				CONSOLIDATED				
Sr.	PANTICULANS	1	Quarter Ende	1	Year	Ended	1	Quarter Ended	i	Year I	Ended
No.		31.03.2022	31.12.2021	31.03.2021	31.03.2022	31.03.2021	31.03.2022	31.12.2021	31.03.2021	31.03.2022	31.03.2021
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	(Audited)
1	Total income from operations	15,336.43	11,636.25	7,725.35	44,826.01	23,073.35	15,336.43	11,636.25	7,725.35	44,826.01	23,073.35
2	Net profit for the period before tax	1,149.30	701.54	682.14	3,244.83	2,081,53	1,149.30	701.54	682.14	3,244.83	2,081.53
3	Net profit for the period after tax	840.04	536.43	525.05	2,438.69	1,578.20	917.51	659.35	694.63	2,898.60	1,744.84
4	Total comprehensive income for the period [comprising profit for the period (after tax) and other comprehensive income (after tax)]										
5	Paid-up Equity Share Capital	2,540.26	2,540.26	2,540.26	2,540.26	2,540.26	2,540.26	2,540.26	2,540.26	2,540.26	2,540.26
6	Other Equity				19170.91	16,975.81				21255.93	18,356.73
7	Earning Per Share (of ₹10 each) (Not annualised)										
	Basic	3.31	2.11	2.07	9.60	6.21	3.61	2.60	2.73	11.41	6.87

The above is an extract of the detailed format of Quarterly and Year end Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 read with SEBI circular 5" July, 2016. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) National Stock Exchange of India Limited (www.nseindia.com) and the Company (www.mmpil.com)

9.60

6.21

3.61

2.60

The above results were reviewed and recommended by the Audit Committee and subsequently approved by the Board of Directors at their respective meetings held on May 30, 2022.

2.07

2.11

FOR AND BEHALF OF THE BOARD

2.73

ARUN BHANDARI Managing Director

DIN No. 00008901

(₹ in Lakhs)

11.41

6.87

Diluted

Place: Nagpur

Dated: May 30, 2022

(Rs. In lakhs)

IndiaNivesh Limited

17th Floor, Lodha Supremus, Senapati Bapat Marg, Lower Parel, Mumbai - 400013 CIN: L99500MH1931PLC001493, Tel No.: 62406240, Fax: 62406241 Email: indianivesh@indianivesh.in, Website: www.indianivesh.in Extract of Standalone and Consolidated Audited Financial Results for the financial year ended March 31, 2022

1				STANDALO	NE			CC	NSOLIDAT	ED	
		QU	ARTER EN	DED	YEAR	ENDED	QU	QUARTER ENDED		YEAR E	NDED
	Particulars	March 31, 2022	December 31, 2021	March 31, 2021	March 31, 2022	March 31, 2021	March 31, 2022	December 31, 2021	March 31, 2021	March 31, 2022	March 31, 2021
		Audited	Unaudited	Audited	Audited	Audited	Audited	Unaudited	Audited	Audited	Audited
1	Total Income from Operations	87,16	53,14	32.70	285.08	134.54	94.14	135.94	151.48	563.70	696.50
ı	Net Profit / (Loss) for the period										
ı	(before Tax, Exceptional and/or Extraordinary items)	(162.85)	(194.54)	800.28	(696.08)	(2.02)	(280.16)	11.36	582.49	(783.94)	(968.64)
ı	Net Profit / (Loss) for the period before tax	- 11				50 701					
ı	(after Exceptional and/or Extraordinary items)	(162.85)	(194.54)	800.28	(696.08)	(2.02)	(280.16)	11.36	582.49	(783.94)	(968.64)
ı	Net Profit / (Loss) for the period after tax										
ı	(after Exceptional and/or Extraordinary items)	207.64	(196.66)	802.04	(327.79)	4.02	(74.78)	234.18	869.13	(389.11)	(1285.14)
ı	Share of Profit / (Loss) of associates		-			(4)	*	-		107- 12	57.37
ı	Net Profit / (Loss) for the period after tax										
ı	(after Share of Profit / (Loss) of associates)	207.64	(196.66)	802.04	(327.79)	4.02	(74.78)	234.18	869.13	(389.11)	(1227.77)
ı	Total Comprehensive Income for the period		2		100		100 100				
ı	[Comprising Profit/Loss for the period (after tax) and other										
ı	Comprehensive Income (after tax)]	207.64	(196.66)	802.04	(327.79)	4.02	(74.78)	236.80	868.33	(389.66)	(1,229.25)
ı	Equity Share Capital (Face Value Re.1/- per share)	377.50	377.50	377.50	377.50	377.50	377.50	377.50	377.50	377.50	377.50
ı	Other Equity as per Audited Balance Sheet as at March 31, 2022				(4846.97)	(4519.17)			4	(3,755.27)	(2,515.66)
	Earnings Per Share (of Re.1/- each)				Maximal's	1812/2016				Che Street	
1	(for continuing and discontinued operations) -										
1	Basic & Diluted	0.55	(0.52)	2.12	(0.87)	0.01	0.43	0.62	2.30	(1.03)	(3.25)

The above is an extract of the detailed format of Standalone and Consolidated Audited Financial Results for the Quarter and Year ened March 31, 2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly financial results are available on the website of Stock Exchange www.bseindia.com and on the Company's website www.indianivesh.in For and on behalf of the Board IndiaNivesh Limited

Place: Mumbai Date: 30/05/2022

Rajesh Nuwal Managing Director DIN: 00009660



(CIN - L24231GJ1998PLC034094)

Regd. Office: 7th Floor, Hasubhai Chambers, Opp. Town Hall, Ellisbridge, Ahmedabad- 380006, Phone No. (O) 079-26574371/72/73, (F) 079-26574374, Email: info@kiriindustries.com website: www.kiriindustries.com

Extract of audited Consolidated Financial Results for the Quarter and Year ended on March 31, 2022

	(Rs. in L								
		Quarter Ende	d	Year	Ended				
Particulars	(31/03/2022)	(31/12/2021)	(31/03/2021)	(31/03/2022)	(31/03/2021)				
	(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)				
Total Income from Operations	41,745.65	42,989.51	36,334.88	1,49,889.81	95,926.59				
Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	1,199.98	3,506.52	3,490.97	6,832.47	3,469.58				
Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	1,199.98	3,506.52	3,490.97	6,832.47	3,469.58				
Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	922.91	2,453.07	3,920.90	5,291.63	2,177.30				
Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	9,070.19	10,601.74	11,613.89	38,844.00	25,238.03				
Paid up Equity Share Capital	5,183.42	3,999.54	3,362.06	5,183.42	3,362.06				
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	=	*	-	2,52,080.64	2,15,082.46				
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)									
Basic:	18.00	26.51	34.54	95.49	75.07				

Diluted:	17.50	20.45	22.41	74.94	48.69	
Brief details of audited Standalone Fin	ancial Results for	the Quarter a	nd Year end	ed on March	n 31, 2022	
			_	(F	Rs. In Lakhs)	
		Quarter Ended Year En				
Particulars	(31/03/2022)	(31/12/2021)	(31/03/2021)	(31/03/2022)	(31/03/2021)	
	(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)	
Total Income from Operations	32,880.93	34,622.38	27,553.37	1,13,866.63	69,117.36	
Profit/(Loss) Before Tax	(536.01)	1,709.59	1,328.10	(1,495.58)	(4,174.48)	
Net Profit/(Loss) for the period after tax	(343.38)	1.116.37	2 220 65	(931.67)	(3.655.91)	

Note:

Date: May 30, 2022

Place: Ahmedabad

- 1. The above is an extract of the detailed audited financial results ("Results") filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full Financial Results are available on website of Stock Exchanges (www.bseindia.com & www.nseindia.com) as well as on the Company's website www.kiriindustries.com.
- 2. The above Result were reviewed by the Audit committee and thereafter approved by the Board of Directors at their meeting held on May 30, 2022.

By order of the Board of Directors

For Kiri Industries Limited Manish Kiri Managing Director



3.31

SIMPLEX INFRASTRUCTURES LIMITED

Regd. Office: "SIMPLEX HOUSE" 27, Shakespeare Sarani, Kolkata - 700 017 PHONES: +91 33 2301-1600, FAX:+91 33 2283-5964/5965/5966 E-mail: simplexkolkata@simplexinfra.com, Website: www.simplexinfra.com CIN No. L45209 WB1924PLC004969

EXTRACT OF STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2022

SI. No.	Particulars	Quarter ended 31st March, 2022	Quarter ended 31st December, 2021	Quarter ended 31st March, 2021	Year ended 31st March, 2022	Year ended 31st March, 2021
		(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)
1,	Total Income from Operations (Net)	48,480	42,449	67,631	1,77,221	2,06,955
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	(20,599)	(21,841)	(15,960)	(77,655)	(69,374
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	(23,063)	(21,841)	(15,960)	(80,119)	(69,374
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	(15,310)	(14,234)	(11,306)	(52,631)	(46,097
5.	Total Comprehensive Income / (Loss) for the period	(14,982)	(14,157)	(11,387)	(51,582)	(48,594
6.	Paid-up Equity Share Capital (Face value of ₹ 2/- Per Share)	1,147	1,147	1,147	1,147	1,147
7.	Reserve (excluding Revaluation Reserve)				75,848	1,27,430
8.	Earnings Per Share (EPS) (Face value of ₹ 2/- each) (not annualised) a) Basic (₹) b) Diluted (₹)	(26.79)* (26.79)*	(24.91)* (24.91)*	(19.79)* (19.79)*	(92.10) (92.10)	(80.67 (80.67

	As at 31st March, 2022	As at 31st March, 2021
	(Audited)	(Audited)
Securities Premium Account	91,980	91,980
Net Worth	62,702	1,15,958
Paid Up Debt Capital/ Outstanding Debt	5,28,436	4,53,859
Outstanding Redeemable Preference Shares		
Debt Equity Ratio	6.86	3.53
Capital Redemption Reserve	1	1
Debenture Redemption Reserve	12,599	12,599
Debt Service Coverage Ratio	(0.09)	(0.13)
Interest Service Coverage Ratio	(0.10)	(0.14)

EXTRACT OF STATEMENT OF CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2022

SI. No.	Particulars	Quarter ended 31st March, 2022	Quarter ended 31st December, 2021	Quarter ended 31st March, 2021	Year ended 31st March, 2022	Year ended 31st March, 2021
		(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)
1,	Total Income from Operations (Net)	58,408	49,919	72,144	2,09,293	2,25,944
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	(22,468)	(22,310)	(16,328)	(80,144)	(70,201
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	(22,468)	(22,310)	(16,328)	(80,144)	(70,201
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	(14,760)	(14,765)	(11,653)	(52,709)	(46,928
5.	Total Comprehensive Income / (Loss) for the period	(14,425)	(14,684)	(11,742)	(51,631)	(49,482
6.	Paid-up Equity Share Capital (Face value of ₹ 2/- Per Share)	1,147	1,147	1,147	1,147	1,147
7.	Reserve (excluding Revaluation Reserve)				73,792	1,25,531
8. b)	Earnings Per Share (EPS) (of ₹ 2/- each) (not annualised) a) Basic (`) Diluted (`)	(26.00)* (26.00)*	(25.95)* (25.95)*	(20.38)* (20.38)*	(92.42) (92.42)	(82.13 (82.13

	As at 31st March, 2022	As at 31st March, 2021
	(Audited)	(Audited)
Securities Premium Account	91,980	91,980
Net Worth	61,025	1,14,462
Paid Up Debt Capital/ Outstanding Debt	5,35,390	4,60,825
Outstanding Redeemable Preference Shares	н	
Debt Equity Ratio	7.13	3.64
Capital Redemption Reserve	1.	1
Debenture Redemption Reserve	12,599	12,599
Debt Service Coverage Ratio	(0.12)	(0.13)
Interest Service Coverage Ratio	(0.12)	(0.13)

Notes:

Kolkata

- a) The above is an extract of the detailed format of Quarterly / year ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 and 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / year ended Financial Results are available on the websites of the Stock Exchange(s) i.e. www.bseindia.com, www.nseindia.com & www.cse-india.com and the company i.e. www.simplexinfra.com.
- b) For the other items referred in Regulation 52 (4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to the Stock Exchange(s) i.e. BSE Limited, National Stock Exchange of India Limited & The Calcutta Stock Exchange Limited and of the company and can be accessed on the www.bseindia.com, www.nseindia.com, www.cse-india.com and www.simplexinfra.com respectively.

For SIMPLEX INFRASTRUCTURES LIMITED S. DUTTA

DIN-00062827

WHOLE-TIME DIRCTOR & C.F.O. Dated: 30th May, 2022









ચોમાસાના આગમનની જાહેરાતમાં વિવાદઃ હવામાન ખાતાએ 'ઉતાવળ' કરી

મરાઠવાડાના

અહમદનગર અને સોલાપુર

જિલ્લામાં છે જે ઘણીવાર દુષ્કાળથી

પ્રભાવિત રહે છે પરંતુ આ વખતે

સારા વરસાદને કારણે પરિસ્થિતિ

બદલાઈ છે અને શેરડીના

વાવેતરમાં વધારો થયો છે.

મામલે વિવાદ સર્જાયો છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચોમાસાના યોગ્ય માપદંડો વિના જ હવામાન વિભાગે ચોમાસાનો પ્રવેશ કરાવી દીધો હોવાનો અભિપ્રાય દર્શાવ્યો છે. જો કે હવામાન ખાતાએ આ વાત નકારી છે અને તમામ માપદંડ યોગ્ય જણાયા

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનો આક્ષેપઃ યોગ્ય માપદંડો ચકાસ્યા વિના જ ચોમાસાનો પ્રવેશ કરાવી દેવાયો. અગાઉની આગાહી 'સાચી' સાબિત કરવા પ્રયાસ

બાદ જ ચોમાસાના પ્રવેશની જાહેરાત કર્યાનું સ્પષ્ટ જણાવ્યું

દેશમાં સૌથી વધુ ખાંડ ઉત્પાદક

રાજ્યોનું સ્થાન બદલાયું છે અને તે

પણ મોટા તફાવત સાથે. વર્તમાન

પિલાણ સિઝનમાં (ઓક્ટોબર.

૨૦૨૧ થી સપ્ટેમ્બર, ૨૦૨૨)

મહારાષ્ટ્રનું ખાંડનું ઉત્પાદન ૧૩૮

લાખ ટન સુધી પહોંચવાનો અંદાજ

છે. જ્યારે ૧૦૪ લાખ ટન ખાંડના

ઉત્પાદન સાથે ઉત્તર પ્રદેશ બીજા

સ્થાન પર પહોંચી ગયું છે. મહારાષ્ટ્ર

૨૦૧૫-૧૬ સુધી ઉત્તર પ્રદેશથી

આગળ હતું. યુપી ૨૦૧૬-૧૭માં

તેનાથી આગળ નીકળ્યું અને

૨૦૨૦-૨૧ની સીઝન સુધી દેશનું

સૌથી મોટું ખાંડ ઉત્પાદક રાજ્ય

બની રહ્યું હતું પરંતુ પ વર્ષ બાદ મહારાષ્ટ્રએ તેને પાછળ છોડ્યું છે.

જોકે, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ઉત્પાદન વધવાને કારણે દેશમાં આ વર્ષે રેકોર્ડ ૩૫૫.૫૦ લાખ ટન ખાંડના ઉત્પાદનનો અંદાજ છે. નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ શુગર ફેક્ટરીઝ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર પ્રકાશ નાયકનવરે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ખાંડના ઉત્પાદનમાં જંગી વધારાના ત્રણ કારણો છે. સારો વરસાદ અને જળાશયોમાં વધુ પાણી, શેરડીના વિસ્તારમાં વધારો અને શેરડીની ઉત્પાદકતામાં મોટો વધારો છે. નાયકનવરે કહ્યું કે, ચાલું પિલાણ સીઝનમાં મહારાષ્ટ્રમાં

શેરડી ઉત્પાદન ૯૦ ટન પ્રતિ

હેક્ટરથી વધીને ૧૦૫ ટન પ્રતિ

હેક્ટર થયું છે. રાજ્યમાં શેરડીની

૮૬૦૩ જાત સારી ઉત્પાદકતા

આપી રહી છે. આ સાથે જ તેમનું કહેવું છે કે, સારા વરસાદ સાથે

ખેડૂતોએ પાકની સારી કાળજી લીધી

છે કારણ કે, તેઓ જાણતા હતા કે,

તેઓને આ વર્ષે શેરડીનો સારો ભાવ

ચારધામ યાત્રાના ૨૭દિવસમાં

૧૦૮ યાત્રાળુનાં મોત થયા દહરાદૂન, તા.૩૧

યાત્રામાં એક મહિનાથી પણ ઓછા

સમયમાં ૧૦૮ યાત્રાળુના અવસાન

૦૩મેથી શરુ થયેલી ચારધામ

અસાની વાવાઝોડાની અસર હેઠળ આંદામાનમાં ચોમાસ્ પણ વ્હેલી એન્ટ્રી થવાની આગાહી કરવામાં આવી હતી. ભારતમાં સામાન્ય રીતે ૧લી જૂને ચોમાસાનો પ્રવેશ થતો હોય છે તેના બદલે ૨૯ મેના પ્રવેશ થઇ ગયો હોવાનું હવામાન ખાતાએ જાહેર કર્યું હતું. પરંતુ સ્કાયમેટ અને અન્ય કેટલીક ખાનગી હવામાન એજન્સીઓએ ચોમાસાનાં પ્રવેશ સામે સવાલ ઉઠાવ્યા છે. સ્કાયમેટે એવો આક્ષેપ કર્યો હતો કે હવામાન ખાતાએ

ભારતમાં ચોમાસાની એન્ટ્રી ત્રણ દિવસ વ્હેલી થઇ ગઇ છે અને હવામાન 🛮 દિવસના વરસાદને ગણતરીમાં લઇને ચોમાસુ આવી ગયાનું જાહેર કર્યું છે તે 🔝 અન્ય કેટલીક ખાનગી વેધર એજન્સીઓએ પણ હવામાન ખાતાની જાહેરાત વિભાગે તેની રવિવારે વિધિવત જાહેરાત પણ કરી દીધી હતી પરંતુ આ નિયત ધોરણો મુજબ નથી. ભૂતકાળમાં ક્યારેય આવી રીતે જાહેરાત થઇ સામે સવાલ ઉઠાવ્યા છે.



૨૨ મેને બદલે ૧૬ મેના રોજ બેસી ગયું હતું અને તેને પગલે ભારતમાં નથી. હવામાન ખાતાએ અગાઉ વ્હેલા ચોમાસાની આગાહી કરી હતી અને તે સાચી સાબિત કરવા માટે જ ચોમાસાનો વ્હેલો પ્રવેશ થઇ ગયો હોવાનું જાહેર કરવામાં આવ્યાનો આક્ષેપ કરાયો છે. સ્કાયમેટના કહેવા પ્રમાણે કેરળમાં હજુ ચોમાસાનો પ્રવેશ થયો નથી. રાજ્યના ૧૪માંથી ૭ ભાગોમાં હજુ વરસાદ પણ થયો નથી ત્યારે ૭ પૈકીના ૨ ભાગોમાં માત્ર ૧ મીમી વરસાદ થયો છે. મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સ્વચ્છ છે તેવા

રાજ્યના શેરડીનું ક્ષેત્રફળ લગભગ રાજ્યમાં વધુ પડતી શેરડીના કારણે

એક લાખ હેક્ટરથી વધીને ૧૨.૪ સુગર મિલો જૂન સુધી પિલાણ ચાલુ

લાખ હેક્ટર પર પહોંચી ગયું છે. રહેવાની અપેક્ષા રાખે છે.

નવી દિલ્હી,તા.૩૧ - ચોમાસાની એન્ટ્રીની જાહેરાત કરવામાં ઉતાવળ કરી દીધી હતી. માત્ર એક - સંજોગોમાં ચોમાસાનો અનુભવ પણ થતો નથી. માત્ર સ્કાયમેટ જ નહીં

ખાનગી હવામાન એજન્સીના આક્ષેપ સામે હવામાન ખાતાના વડા મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું હતું કે હવામાન વિભાગ ક્યારેય વિજ્ઞાન સાથે બાંધછોડ કરતું નથી. માત્ર અમુક ખાનગી એજન્સીઓ જ નહીં પરંતુ વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓના મંતવ્યોનો પણ આધાર લે છે. હવામાન આગાહીમાં વિભાગ

હવામાન વિભાગનો ઇન્કાર, તમામ માપદંડો પૂર્ણ થયા પછી ચોમાસાના આગમનની જાહેરાત કરી હતી

પ્રતિષ્ઠા ધરાવે છે અને ક્યારેય ઉપરછક્ષી આગાહી કરતું નથી. સતત બે દિવસના વરસાદ પછી જ ચોમાસાનો પ્રવેશ જાહેરાત કરવામાં આવ્યો છે. ખાનગી એજન્સીઓ એવું માનતી હોય કે રાજ્યભરમાં એક સમાન ધોરણે વરસાદ થાયતો જ ચોમાસાનો

પ્રવેશ ગણાય તો તે બાબત શક્ય નથી.

સ્કાયમેટના વાઈસ પ્રેસીડેન્ટ મહેશ પાલાવતે એવો દાવો કર્યો કે ખાનગી એજન્સીઓ પણ હવામાન વિભાગે નક્કી કરેલા માપદંડોને જ અનુસરતી હોય છે અને તેના આધારે જ એમ માને છે કે ચોમાસાના પ્રવેશની જાહેરાતમાં ઉતાવળ કરવામાં આવી છે અને માત્ર પવન તથા ઓએલઆરને આધાર જ બનાવવામાં આવ્યો છે.

શહીદ નાયક દીપક સિંહના પત્નીએ ઓટીએમાં ટ્રેનિંગ શરૂ કરી

શહીદ નાયક દીપક સિંહના પત્ની રેખા દેવીએ ચેન્નાઈના ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી (ઓટીએ)માં પોતાની ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. દીપક સિંહ જૂન ૨૦૦૬માં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) સાથેની અથડામણમાં શહીદ થયા હતા. આ અથડામણમાં ભારતના કલ ૨૦ જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બિહાર રેજિમેન્ટની ૧૬મી બટાલિયનના નાયક દીપક સિંહને નવેમ્બર ૨૦૨૧માં દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા મરણોત્તર વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. શહીદની પત્ની રેખા દેવી પણ સેનામાં ભરતી થઈ દેશની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

મધ્યપ્રદેશના રીવા જિલ્લાની રહેનારી રેખા દેવી સર્વિસ સેલેક્શન બોર્ડના ઈન્ટરવ્યુમાં પાસ કર્યા બાદ ઓટીએ ટ્રેનિંગ લેવાની શરૂ કરી દીધી છે.

बैंक ऑफ़ इंडिया Bank of India BOI

ગ્રી મલકેશ ફર્મદરામ દોશી

૦૦૧ શ્રુષ્ટિ એપાર્ટમેન્ટ, સંજીવની સામે, ક્રોસ્પિટલ જૈન નગર પાલકી, અમદાવાદ - ૩૮૦૦૦૯ દ્યી સિક્યુરિટાઈડેશન એન્ડ રિકન્ટ્રક્થન ઓફ ફાયનાન્સિયલ એશેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ના સેક્શન ૧૩(૨) ફેઠળ

૧. બેંકે તમારી વિનંતીથી વિવિધ શાખ સવલતોની બળીને એકંદરે કુલ ૨કમ ગ્રા. ૫,૫૦,૦૦૦ (ગ્રા. પાંચ શાખ પ્રચાસ કુષ્કાર માત્ર) આપેલ. અમે અમારા દારા આપવામાં આવેલ વિવિધ શાખ સવલતોની અને તે પછી નોટિસની તારીખે તમારી પાસે લેલી થતી રકમોની વિગતો નીચે આપીએ છીએ.

d.	शवस्त्रचनो प्रहार	मंपुर धबेत मर्बाटा	બાહી રહય
1	SRTO Loan: 201372310000040	Rs. 5,50,000.00	Rs. 3,92,194.84
	Total	Rs. 5,50,000.00	Rs. 3,92,194.84
ã,	દારા અપાયેલ સદરહ શાખ સવલતો સામે	નીચેન વાકન લેંકને કાઇપે	તાલીકોક આપવામાં આવી

- महिन्त्रा BOL मेशी द्वत पत्रस MDI BS3PS तेनो सिरीयल नंधर MA1ZT2GLKL2H21113 અને ঐপুল ল'লং GLG4H82348 અને ইথীয় ল'লং MA1ZTZGLKL2H21113 and see DMNDWHIT 2002 to nine GJ-01-ET-
- તમે બેંકને કવિત શાખ સવલત હેઠળના તમારા બાકી લેશા ચૂકવવામાં કસૂર કરેલ હોઈ, અમે તમારા પરફ્રોમિંગ એસેટ તરીકે વર્ગીકૃત કરેલ છે.
- ૪. ઉપર જુવાવેલ કારણોસર, અમે આપને ઉપર જુવાવેલ કાયદાના સેક્શન ૧૩(૨) તેઠળ નોટિસ મોકલીએ છીએ અને આપને બેંકને (૧) રૂા. ૩,૯૨,૧૯૪.૮૪ નોટીસની તારીખ સુધી કોન્ટ્રાકચ્યુઅલ બાકી વ્યાજ ૯.૨૫% વાર્ષિક દર સાથે ઉપરોક્ત શાબ સવલતોમાં જણાવ્યા મુજબ લાગુ થતું વધારાનું વ્યાજ માસિક ગાળાના ગણાતા વ્યાજ સહિત તેમ જ તમામ ખર્ચા અને કોસ્ટ્સ જે કંઈ બેંકને થાય તે સમિત આ નોટિસની તારીખથી દિન ૯૦ માં રકમ ભરપાઈ કરી તમારી જવાબદારી પૂરી કરવા જવા જણાવીએ છીએ. એમાં કસૂર થયેથી નોંધ લેશો કે અમે તમારા ખર્ચે અને જોખમે તેમ જ બેંકને સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્શિયલ એક્ષેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ના સેક્શન ૧૩ કેઠળ મળેલ અધિકારની રૂએ ઉપર જણાવેલ સિક્યુર્ડ અસ્ક્યામત વિરુદ્ધ પગવાં લઇશું.
- જ્યારે અમે તમને તમારી ઉપર જણાવેલ જવાબદારી બેંકને લેણી તમામ રકમ લાગુ પડતા વ્યાજ તમામ કિંમતો, ચાર્જેસ અને ખર્ચા સહિત બરપાઈ કરીને પૂરી કરવા જણાવીએ છીએ ત્યારે નોંધ લેશો કે સરફેંસી કાયદાના સેક્શન ૧૩(૮) મુજબ તમને સિક્યોર્ડ અસ્ક્યામતો છોડાવવાનો તમને અધિકાર મળે છે પણ એ માટે તમારે જાહેર હરાજની નોટિસ છપાયાની તારીખ અગાઉ કે મિલકતની તબદિલી લીઝ, એસાઈનમેન્ટ કે વેચાલ દારા જાતેર જનતા પાસે જાતેર કે ખાનગી કરાર દારા કવોટેશન્સ કે ટેન્ડર મંગાવવા અગાઇ પૂરેપૂરી ૨કમ ભરપાઈ કરી દેવાની રહેશે.
- ઉપર જણાવેલ સત્તાના ઉપયોગ પછી વસૂલ થયેલ ૨કમ, પહેલાં તો અમે કરેલા તમામ કિંમતો, ચાર્જેર અને ખર્ચાઓ અને /અથવા થનાર ખર્ચ સામે લેવામાં આવશે અને તે પછી બેંકના ઉપર દર્શાવેલ બાકી લેણા સામે આ નોટિસની તારીખથી ખરેખર પૈસા મળે તે તારીખ સુધીનું કરાર આધારિત દરે થતા વ્યાજ સાથે લેવાશે અને પછી બાકી કંઈ રહેતું હોય તો બેંકનું પૂરેપુરું દેવું ચૂકવ્યા પછી (દેશદાર કે જામીનદાર તરીકે તથારા બેંકને આપવાના થતા અન્ય કોઈ દેશાસહિત) કંઈ વર્ષ તો તમને આપવામાં આવશે.
- જો કથિત દેશી રકમ સિક્યોર્ડ અસ્ક્યામતો સામે કથિત સત્તાના ઉપયોગની કવાયત દ્વારા થયેલ પ્રક્રિયામાં પૂરેપૂરી વસૂલ નથી થતા તો અમે તમામ ખર્ચ વગેરે થનાર-થયેલ સહિત તમારી પાસેથી બાકી રકમ વસૂલ કરવા માટે તમારી સામે તેમ જ તમારી અન્ય અસ્ક્યામતો સામે ઋલ વસૂલી/ટ્રેબ્યુનલ કોર્ટ રાહે કાનૂની/વસૂલાતના પગલાં લેવા માટે અપારો અધિકાર સુરક્ષિત રાખીએ છીએ ૮. મહેરબાની કરીને નોંધ લેશો કે ઉપરોક્ત કાયદાના સબ-સેક્શન (૧૩) મુજબ આ નોટિસ મળ્યા પછી,
- આપને વેચાલ, લિઝ, લાયસન્સ, બેટ, ગિરવે કે અન્ય કોઈ રીતે ઉપરોક્ત સિક્યોર્ડ અસ્ક્યામતોને તબદિલ કરવા સામે કે કોઈ કરભારણ ઊભું કરવા સામે મનાઈ કરમાવવામાં આવે છે. નીચે સહી કરનાર એ બેંકના અધિકૃત અધિકારી છે અને ઉપરોક્ત કાયદાના સેક્શન ૧૩ હેઠળ મળેલ
- સત્તાની રૂએ આ નોટિસ આપેલ છે. ૧૦. એ કહેવાની જરૂર નથી કે આ નોટિસ તમને બેંકને ઉપશબ્ધ અન્ય ઉપાયના પૂર્વગ્રહ સિવાય આપે:

તારીખઃ ૨૦.૦૫.૨૦૨૨ સ્થળઃ દીતીફ રોક, અમદાવાદ

આપનો વિશ્વાસ લર એસ નરવાદીયા अधिकृत अधिकारी

RIDDHI CORPORATE SERVICES LIMITED CIN: L74140GJ2010PLC062548

મળશે.રાજ્યમાં ચાલુ વર્ષે ખાંડનું હતો , જ્યારે રાજ્યના સુગર સુગરમિલોમાં નોંધાયેલ ન હતો .

ઉત્પાદન વધવાનું એક કારણ બિન કમિશનરની ઓફિસના જણાવ્યા મોટાભાગના બિન નોંધાયેલ

દેશમાં ખાંડનું રેકોર્ડ ૩૫૫.૫૦ લાખ ટન ઉત્પાદનનો અંદાજ

દેશમાં વધુ ખાંડ ઉત્પાદક

રાજ્યોનું સ્થાન બદલાયું

વિસ્તાર ૧૧.૪૨ લાખ હેક્ટર આ વધારાનો શેરડીનો વિસ્તાર

જેને બિન નોંધાયેલ શેરડીનો

૨૦૨૦-૨૧માં રાજ્યનો શેરડીનો

વિસ્તાર કહેવામાં આવે છે. વર્ષ

નોંધાયેલ શેરડીનો વિસ્તાર પણ છે. પ્રમાણે વર્તમાન પિલાણ સિઝનમાં વિસ્તાર

Regd. Office: 10, Mill Officers Colony, Behind Old RBI, Ashram Road, Ahmedabad - 380009 Phone: (079) 26580767 Web: www.riddhicorporate.co.in E-Mail: Investor@rcspl.net EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE YEAR ENDED ON 31TH MARCH, 2022 (Figures in Lakhs)

Sr. 10	Particulars	Quarter ended on 31/03/2022 (Audited)	Quarter ended on 31/12/2021 (Unaudited)	Quarter ended on 31/03/2021 (Audited)	Year ended on 31/03/2022 (Audited)	Year ended on 31/03/2021 (Audited)
t	Total income from Operations (Net)	3,868.66	3,293.74	2,809.06	11,629.22	8,980.10
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#) Net Profit / (Loss) for the period before tax	203.75	289.30	93.14	784.08	478.39
1	(after Exceptional and/or Extraordinary items#)	203.75	289.30	93.14	784.08	478.39
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	216.48	99.78	114.40	410.75	288.29
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	94	-	_		92
5	Equity Share Capital	1,137.50	1,137.50	1,137.50	1,137.50	1,137.50
1	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	\$ <u>0</u> 1	32	2	20 E	32
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	*******	11000000		11.5053	
1	- Basic - Diluted	1.53 1.53	1.90	0.18 0.18	5.14 5.14	2.72

The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company

at their respective meetings held on May 30, 2022.

The above results for the quarter ended on March 31, 2022 have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable.

The format of the above results as prescribed in SEBI's Circular CIR/CFD/CMD/15/2015 dated 30th November, 2015

has been modified to comply with the requirements of SEBI's Circular dated 5th July, 2016, Ind AS and Schedule III [Division II] to the Companies Act 2013.

The Chief Operating Decision Maker "CODM" reviews the operations of the Company as a whole, hence there are no reportable segments as per Ind AS 108 "Operating Segments"

Previous year's / period's figure have been regrouped / rearranged wherever necessary


The figures for quarter ended March 31, 2022 are balancing figures between the audited figures of the full financial year and the reviewed year-to-date figures upto the third quarter of the financial year.

During the current Quarter company has received incentive from Ministry of Skill Development and Enterpreneurshis under National Apprenticeship Promotion Scheme (NAPS) amounting to Rs. 13.73 lakhs which is shown under indirect income in the Statement of Profit and Loss Account. The outbreak of Coronavirus (Covid-19) globally and in India is causing significant disturbance and slowdown of

economic activity. The company has evaluated its impact on its business operations and based on its review and current indicators of future economic conditions. The Company has taken into, account the possible impacts of COVID-19 in preparation of the financial results, including but not limited to its assessment of liquidity, and going concern tion, recoverable values of its financial and non-financial assets, impact on revenues and on cost budgets. By Order - For, Riddhi Corporate Services Limited

Place: Ahmedabad Date: 30/05/2022

Mustafa Sibatra Company Secretary & Compliance Officer



ચાલેલી આ યાગામાં ૯૦ યાત્રાળુ મોતને ભેટચા હતા, 8412 ૨૦૧૮માં આ આંકડો ૧૦૨ અને ૨૦૧૭માં ૧૧૨ હતો ૨૦૨૦ અને २०२१मा કોરોનાકાળ દરમિયાન यागानु આયોજન ના થયું હોવાથી મૃત્યુ પામનારા શ્રદ્ધાળું ઓ નો આંકડો ખૂબ જ નીચો હતો. જોકે, ચાલુ વર્ષે એક મહિનાથી Basic & Diluted પણ ઓછા સમયમાં રેકોર્ડ સંખ્યામાં યાત્રાળુના મોત થતાં સૌ કોઈને એક જ સવાલ

સતાવી રહ્યો છે

આટલી મોટી

સંખ્યામાં

મોતનું કારણ શું

આખરે

GUJARAT TERCE LABORATORIES LIMITED

Reg. Office:- 122/2, Ravi Estate, Bileshwarpura, Chhatral, Dist. Gandhinagar (Gujarat) Phone: - 079 - 41005079, CIN NO: L24100GJ985PLC007753 email: gtll.factory@gmail.com website:www.gujaratterce.in

Extract of Standalone Audited Financial Results for the Quarter and Year Ended March 31, 2022.

[Rs.In Lakhs except per share detail]							
Destinutes:		Quarter Ende	d	Financial Year Ended			
Particulars	31.03.2022	31.12.2021	31.03.2021	31.03.2022	31.03.202		
Total income from operations Net Profit / (Loss) for the period (before Tax, Exceptional	932.45	1074.6	591.51	4013.37	2517.79		
and/or Extraordinary items) Net Profit / (Loss) for the period before Tax	-185.95	55.21	-199.98	74.66	-253,16		
(after Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period after Tax (after Exceptional	-185.95	55.21	-199.98	74.66	-253,16		
and/or Extraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit /(Loss) for the period (after tax) and	-165.88	47.71	-198.84	87.23	-252,02		
Other Comprehensive Income (after tax)]	-165.88	47.71	-198.84	87.23	-252.02		
Equity Share Capital	742.03	742.03	742.03	742,03	742.03		
Reserves (excluding Revaluation Reserve) Earnings Per Share (of Rs. 10/- each)	111.4	24.17	24.17	111.4	24.17		
					0200231		

Notes:

Place: Ahmedabad

Date: 30.05.2022

1 The above results have been reviewed by the audit committee of the Company and taken on record by the Board of Directors of the Company in its meeting held on 30/05/2022 and same are also been reviewed by the statutory auditors of the Company

0.00

0.64

2 The Above Audited Results have been prepared and presented as per Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended ("Ind AS") prescribed under section 133 of the Companies Act, 2013 and in terms of Regulations 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "Listing Regulations"), as modified by Circular dated August, 10, 2016

3 The above is an extract of the detailed format of Audited Financial Results for the quarter and year ended on March 31, 2022 filed with the Stock exchanges as per SEBI (Listing Obligations and Disclosure Requirement) Regulations, 2015. The full format of standatione Audited financial results are available on the website of BSE at www.bseindia.com and on company's website www.gujaratterce.in.

> By and order of the Board of Director For Gujarat Terce Laboratories Limited Sd/

0.00

1.18

-3.40

Aalap Prajapati (Managing Director and CEO) DIN: 08088327

APOLLO

GUJARAT APOLLO INDUSTRIES LTD.

CIN No. L45202GJ1986PLC009042. Web: www.apollo.co.in Rogd. Off: Block No. 486, 487, 488, Mouje Dholasan, Taluka & District: Mehsana-382732. Corp. Off: "Parishram", 5-B, Rashmi Society, Nr. Mithakhali Six Road, Navrangpura, Ahmedabad-380009.

Corp. Off: "Parishram", 5-B, Hashini Society, nr. milliannell St. November 1980 ON MARCH 31, 2022

EXTRACT OF THE STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED ON MARCH 31, 2022

(\$\foat{X}\$ in Lakhs except earning per share data

Sr No	Particulars	Standalone			Consolidated		
		Querter Ended	Year Ended		Querter Ended	Year	Ended
		31.03.2022	31.03.2022	31.03.2021	31.03.2022	31.03.2022	31.03.2021
18.3		Audited	Audited	Audited	Audited	Audited	Audited
1	Total Income from operations	1,132.31	4,221.08	4,411.39	2,841.56	8,146.12	15,360.94
2	Net Profit for the Period (Before Exceptional items and Tax)	48.85	17.02	168.44	497.48	1,376.65	8,202.14
3	Net Profit for the Period Before tax (After Exceptional)	48.85	17.02	168.44	497.48	1,376.65	8,202.14
4	Net Profit for the Period After tax	58.66	87.53	207.21	251.66	818.01	4,460.19
5	Total Comprehensive income for the period (Comprising profit for the period (Comprising profit for the period (after tax) and other comprehensive income (after tax)	58.66	87.53	185.71	767.36	1,730.65	4,659.45
6	Paid-up equity share capital (face value of ₹ 10(- each)	1,180.00	1,180.00	1,266.19	1,180.00	1,180.00	1,266.19
7	Other Equity (excluding revaluation reserve)	240224000	22,040.49	24,325.96	12.3400.23.01.1	51,168.56	52,059.80
8	Earnings Per Share (For Continuing Operations)		367.257.26.35	ACTOR AND AND AND		38.00000000	740793456
	Basic (in ₹)	0.50	0.74	1.64	1.93	7.87	35.91
	Diluted (in ₹)	0.49	0.74	1.64	1.92	7.82	35.91

Note: The above is an extract of the detailed format of quarterly / yearly financial results filed with the stock exchange under regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly I yearly financial results is available on the company website at www.apollo.co.in , on the BSE website at www.bseindia.com and on the NSE website www.nsein

Date: 30-05-2022

For and on behalf of Board of Director. **GUJARAT APOLLO INDUSTRIES LIMITED** Asit A. Patel - Managing Director DIN: 00093332



Future Full of Colours ...

(CIN - L24231GJ1998PLC034094) Regd. Office: 7th Floor, Hasubhai Chambers, Opp. Town Hall, Ellisbridge, Ahmedabad- 380006,

Phone No. (O) 079-26574371/72/73, (F) 079-26574374, Email: info@kiriindustries.com website: www.kiriindustries.com

				(F	Rs. in Lakhs
	1	Quarter Ended	Year Ended		
Particulars	(31/03/2022)	(31/12/2021)	(31/03/2021)	(31/03/2022)	(31/03/2021)
	(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)
Total Income from Operations	41,745.65	42,989.51	36,334.88	1,49,889.81	95,926.59
Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	1,199.98	3,506.52	3,490.97	6,832.47	3,469.58
Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	1,199.98	3,506.52	3,490.97	6,832.47	3,469.58
Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	922.91	2,453.07	3,920.90	5,291.63	2,177.30
Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	9,070.19	10,601.74	11,613.89	38,844.00	25,238.03
Paid up Equity Share Capital	5,183.42	3,999.54	3,362.06	5,183.42	3,362.06
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year				2,52,080.64	2,15,082.46
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)			VII		
Basic:	18.00	26.51	34.54	95.49	75.07
Diluted:	17.50	20.45	22.41	74.94	48.69

Brief details of audited Standalone Fin	ancial Results for	the Quarter a	na year ena	NATIONAL PROPERTY OF THE	MANUFACTURE CONTRACTOR		
(Rs. In Lakh							
		Year Ended					
Particulars	(31/03/2022) (Audited)	(31/12/2021) (Unaudited)	(31/03/2021) (Audited)	(31/03/2022) (Audited)	(31/03/2021) (Audited)		
						Total Income from Operations	32,880.93
Profit/(Loss) Before Tax	(536.01)	1,709.59	1,328.10	(1,495.58)	(4,174.48)		
Net Profit/(Loss) for the period after tax	(343.38)	1,116.37	2,220.65	(931.67)	(3,655.91)		

Note:

The above is an extract of the detailed audited financial results ("Results") filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full Financial Results are available on website of Stock Exchanges (www.bseindia.com & www.nseindia.com) as well as on the Company's website www.kiriindustries.com

The above Result were reviewed by the Audit committee and thereafter approved by the Board of Directors at their meeting held on May 30, 2022.

> By order of the Board of Directors For Kiri Industries Limited Manish Kiri

Date: May 30, 2022 Place: Ahmedabad

Managing Director